



SAURASHTRA UNIVERSITY

EXAM SECTION-01

Accredited Grade "A" by NAAC
(3rd Cycle)

University Campus, University Road, Rajkot – 360005
PhoneNo.: (0281) 2576511 Ext. No.736/737/738 FAX No.: (0281) 2586411
E-mail Id: exam01@sauuni.ac.in

નં.ક્રમાંક/પરીક્ષા/૦૧/૭૯/૨૦૨૧

તા.૨૩/૦૨/૨૦૨૧

પરિપત્ર:-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજનાં આચાર્યશ્રી/ભવનોનાં અધ્યક્ષશ્રી/માન્ય અનુસ્નાતકસંસ્થાઓનાં વડાઓને જણાવવામાં આવે છે કે “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એકેડેમિક વિભાગદ્વારા પરિપત્રિત કરવામાં આવેલ ક્રમાંક નં.એકે/૬૦૨/૨૦૨૦ તા.૧૨/૧૧/૨૦૨૦ નાં પત્રથી COMMON ORDINANCEનો અમલ એકેડેમિક વર્ષ ૨૦૨૦-૨૧ થી કરવાનો થતા Ordinance-02મુજબ વર્ષ ૨૦૧૬ પહેલાનાં એનરોલ થયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવા માટેની તક આપવામાં આવશે નહિ તેમજ તેઓ પરીક્ષા ફોર્મ ભરવા એલીજબલ થઈ શકશે નહિ તેવું જણાવવામાં આવેલ છે.

વધુમાં એકેડેમિક વિભાગનાં તા.૧૮/૦૨/૨૦૨૧ નાં પરિપત્ર એકે/૨૮૭/૨૦૨૧ પ્રમાણે જુદી જુદી સાત વિદ્યાશાખાઓનાં ડીનશ્રીઓની ભલામણ અન્વયે O.GEN. 1 થી 26 માં સમાવિષ્ટ O.GEN. 2 તથા O.GEN.-21 નો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ થી કરવા મા.કુલપતિશ્રીએ અધિકાર મંડળોની બહાલીની મંજૂરી આપેલ હોય જેના અનુસંધાને યુ.જી.કક્ષાએ ૨૦૧૬ પહેલાનાં જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૨ થી ૬ પાસ હોય પરંતુ ફક્ત સેમેસ્ટર ૧ માં કેટી હોય તથા પી.જી કક્ષાએ ૨૦૧૭ પહેલાના જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૨ થી ૪ પાસ હોય પરંતુ ફક્ત સેમેસ્ટર ૧ માં કેટી હોય ફક્ત તેવા વિદ્યાર્થીઓ માટે નીચે દર્શાવેલ તારીખ થી પરીક્ષા ફોર્મ ભરવા માટે ચાલુ કરવામાં આવશે.

આ કોર્સમાં ફક્ત ને ફક્ત (W.E.F 2016) પહેલાનાં જે વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવાની રહેશે.

પરીક્ષા ફોર્મ ખુલવાની તા. ૧૫/૦૩/૨૦૨૧

ઉપર મુજબનાં ભરાયેલ ફોર્મ ની પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તો આચાર્યશ્રીઓ/અધ્યક્ષશ્રીઓને વિનંતી કે ઉક્ત બાબત ખાસ ધ્યાને લેશે તેમજ આપની કોલેજ/ભવનનાં વિદ્યાર્થીઓને ઉક્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપાયેલ તકનો મહત્તમ લાભ લઈ શકે તે માટે બહોળી પ્રસિદ્ધિ કરવા વિનંતી છે.

hijhni
પરીક્ષા નિયામક